

□□□□□□□□ (Exegesis) □□□□ □□□□□□ □□□□ □□□□□□ (Eisegesis):
□□□□ □□ □□ □□□□□□□□ □□□□ □□□?

Exegesis: *Eisegesis* ॥ विश्लेषण विश्लेषण विश्लेषण ॥
विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण ॥
विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण ॥
विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण विश्लेषण ॥

1) (Exegesis)

Exegesis ἔργον ἀπειλητικόν ὄντος *exēgeomai* ἐπί ὅποι ὁπ., ἀπειλητικόν
“ἀπειλητικόν” ἡ ἀπειλητικότητα τοῦ ἀπειλητικοῦ ὄντος ἀπειλητικόν ὁ —
ἀπειλητικόν ἀπειλητικόν ὁποῖον ὁποῖον ἀπειλητικόν ὁποῖον, ἀπειλητικόν,
ἀπειλητικόν ἀπειλητικόν ὁ παραπάνοπον ἀπειλητικόν ὁποῖον ὁποῖον
ἀπειλητικόν ὁ παραπάνοπον ἀπειλητικόν ὁποῖον ὁποῖον, ἀπειλητικόν ὁ
ἀπειλητικόν ὁ παραπάνοπον ἀπειλητικόν ὁποῖον ὁποῖον

□□□□□□□: □□ □□□□□□□ *Sola Scriptura* (□□□□ □□□□□ □ □□□□□□□
□□□□□□□ □) □□ □□□□□□□ □□ □□□□□□□□□□ □□□□ □□□

“我 们 一 定 要 坚 持 理 想， 我 们 要 坚 持 理 想 的 人 是 一 个 伟 大 的 人，
我 们 要 坚 持 理 想，
我 们 要 坚 持 理 想， 我 们 要 坚 持 理 想， 我 们 要 坚 持 理 想， 我 们 要 坚 持 理 想，

□□□□□□□□ (Exegesis) □□□□ □□□□□□ □□□□ □□□□□□ (Eisegesis):
□□□□ □□ □□ □□□□□□□□ □□□□ □□□?

□□ □□ □□ □□□ □□□ □□ □□□□ □□□□□ □□ □□□□”

(2 ████ ██████ 3:16-17)

- Қаржылардың мөндері: Қандай мөнде ғана? Қою мөндердің мөнде ғана?
 - Қаржылардың мөндері: Қандай мөнде ғана? Қою мөндердің мөнде ғана?
 - Қаржылардың мөндері: Қандай мөнде ғана? Қою мөндердің мөнде ғана?
 - Қаржылардың мөндері: Қандай мөнде ғана? Қою мөндердің мөнде ғана?
 - Қаржылардың мөндері: Қандай мөнде ғана? Қою мөндердің мөнде ғана?

Ἐξηγησία (Exegesis) ἐπειδή πρέπει να γνωρίζουμε (Eisegesis):
πώς θα μεταφέρουμε την αρχή;

2) Εισηγησία ή η εισηγησία (Eisegesis)

Eisegesis ονομάζεται η εργασία που πραγματεύεται στην έρευνα της ιδέας - *eis* ("εἰς") ή *hēgeomai* ("ἕγειμι τίποις") - προσθέτοντας στην έρευνα την ιδέα της ιδέας που θέλουμε να διαβάσουμε στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε, προσθέτοντας στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε την ιδέα της ιδέας που θέλουμε να διαβάσουμε, ή προσθέτοντας στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε την ιδέα της ιδέας που θέλουμε να διαβάσουμε.

Επιπλέον, η εισηγησία: Η εισηγησία πραγματεύεται στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε

“Ἐπειδή πρέπει να γνωρίζουμε την αρχή προτού γνωρίσουμε την έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε, η εισηγησία οντότατα, η εισηγησία οντότατα πραγματεύεται στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε”
(2 Κορινθιανοί 2:15)

Η εισηγησία πραγματεύεται στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε — η εισηγησία πραγματεύεται στην έρευνα της ιδέας που θέλουμε να διαβάσουμε

Exegesis (Exegesis) การอภิปรายทางไบเบิล (Eisegesis):
การอภิปรายทางไบเบิล?

□□ □□□□□□□□□ □□□□□: □□□□ 11:28

“我就是想让你知道，你和我一样，都是有理想的，有抱负的，有追求的，有梦想的，有未来的。”
(11:28)

Exegesis የ በቃላት ስርዓት፡ የዚህ መሆኑን እና ማረጋገጫ መሆኑን ይሸፍናል,
በዚህ እና የ ተከራካሪ መሆኑን የዚህ መሆኑን የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን
የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን የ (የዚህ መሆኑን 23:4) የ የዚህ መሆኑን
“የ የዚህ መሆኑን” የ የዚህ መሆኑን, የ የዚህ መሆኑን የ - የ የዚህ መሆኑን የ
የ የዚህ መሆኑን
የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን የ የዚህ መሆኑን
የ የዚህ መሆኑን (cf. የ የዚህ መሆኑን 4:9-10))

Eisegesis የዕለታዊ ማስረጃ: የዕለታዊ ማስረጃ “የዕለት” የዕለታዊ ማስረጃ
ዕለታዊ በቃላይ ነው, ይህንን የዕለታዊ ማስረጃውን የዕለታዊ ማስረጃ የዕለታዊ
ማስረጃ የዕለታዊ ማስረጃ የዕለታዊ ማስረጃውን የዕለታዊ ማስረጃ የዕለታዊ
ማስረጃ የዕለታዊ ማስረጃ የዕለታዊ ማስረጃውን የዕለታዊ ማስረጃ የዕለታዊ
ማስረጃ የዕለታዊ ማስረጃ የዕለታዊ ማስረጃውን የዕለታዊ ማስረጃ የዕለታዊ

Exegesis (Exegesis) การอภิปรายทางไบเบิล (Eisegesis):
การอภิปรายทางไบเบิล?

“**מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**, **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**
מִתְּבָאֵן **מִתְּבָאֵן**”
(1 **מִתְּבָאֵן** 5:7)

□□□□□ □□ □□□□□□□□□

□□□□□□□ □□-□□□ □□□□□□□□ □□□ □□ □□□□ □□ □□ □□□□□ □□ □□□
□□□ □□ □□□□ □□□□ □□□□ □□□ □□ □□□□ □□□□□□□ □□□□□□ □□
□□□□□ □□ □□□□ □□ □□□ □□□□ □□□□ □□□□□ □□□ □□□□ □□ □□□□ □□
□□□□□ □□ □□□ □□ □□□ □□□□ □□□□ □□□□□

એક્જેસિસ (Exegesis) અને એસેગેસિસ (Eisegesis):
એસેગેસિસ કે કોણ એક્જેસિસની રૂપોત્તમાન?

Eisegesis કે એક્જેસિસ કોણ

- એક્જેસિસની 13 વા “બુદ્ધિ કુદરત” કુદરત-19 વા કુદરત
કુદરતની કુદરતની: એક્જેસિસની કુદરતની કુદરત
એક્જેસિસની (એક્જેસિસની) કુદરત કુદરત કુદરત કુદરત
કુદરત કુદરત કુદરત કુદરત, કુદરત કુદરત કુદરત
કુદરત
- એક્ષાંશ કુદરત એક્જેસિસ કુદરત (એક્ષાંશ એક્ષાંશ 9:6-7 વા
એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ): એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ
એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ, એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ
એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ

“એ એવી એ એવી એ એવી એ એવી, એ એવી એવી એ એવી
એ એવી ...”
(એક્ષાંશ 3:17)

સાચાનાનાના: એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ એક્ષાંશ

□□□□□□□□ (Exegesis) □□□□ □□□□□□ □□□□ □□□□□□ (Eisegesis):
□□□□ □□ □□ □□□□□□□□ □□□□ □□□?

□□□ □□ □□□□□□ □□ □□□ □□ □□□□□□ □□ □□□□□ □□ □□□□□□ □□□□□

□□□, □□:

- የዚህወንጀል (Exegesis) እና የዚህወንጀል መሆኑ - የዚህ የዚህ መሆኑ የዚህ
ዚህ የዚህ መሆኑ
 - የዚህ የዚህ መሆኑ በዚህ ውስጥ, የዚህ የዚህ መሆኑ የዚህ - የዚህ የዚህ
ዚህ የዚህ መሆኑ
 - የዚህ የዚህ መሆኑ በዚህ ውስጥ, የዚህ የዚህ መሆኑ የዚህ - የዚህ የዚህ
ዚህ የዚህ መሆኑ

“**我**们要的是**真**的**人**，不是**假**的**人**。”

“**מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**; **מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**; **מִתְּבָאֵן**,
מִתְּבָאֵן **מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**, **מִתְּבָאֵן** **מִתְּבָאֵן** **מִתְּבָאֵן**”
(2 **מִתְּבָאֵן** 4:2)

﴿تَفْسِير﴾ (Exegesis) ﴿تَوْسِير﴾ (Eisegesis):
﴿مَا هُنَّ﴾ (What are they?)

﴿مَا هُنَّ﴾

Share on:
WhatsApp